



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૨/૦૩/૨૦૧૯ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૧૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૦૬ કેસ કરી, ૯૬ વ્યક્તિઓને ઝડપી, ૨૫૨ લીટર દેશી દારૂ, ૭૪ બોટલ ઇંગ્લીશ દારૂ, ૬૩ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૪ બિયર ટીન, ૧ મોટર સાયકલ અને ૨ સ્કુટર કબજે કર્યા હતા. તેમજ જુગારધારા હેઠળ ૬ કેસ કરી ૨૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૮૦,૬૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૨૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૯૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૩૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

લુંટની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૫૨૧/૧૯

એરપોર્ટ: પ્રવિણાબહેન વા/ઓફ જીતેન્દ્રભાઈ ભાવસાર (ઉ.વ.૫૫) (રહે. દેવભુમી ફ્લેટ બીજો માળ દેવસાનો પાડો સ્વામિનારાયણ મંદીર રોડ કાલુપુર) તા.૨૧/૦૩/૧૯ રાતના ૮/૧૫ વાગ્યાના સુમારે હોટલ આશ્રય ઈન સામેથી એકટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ પ્રવિણાબહેનના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૪૫,૫૦૦/- ખેચી ઝુંટવી લુંટ કરી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ પ્રવિણાબહેન ભાવસારે એરપોર્ટ પ્લીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.બી.પ્રજાપતિ ચલાવે છે.

નવજાત ભૂણ મળી આવવા બાબત:-

સમાચાર યાદી નં.૫૨૨/૧૯

અમરાઈવાડી: તા.૨૧/૦૩/૧૯ કલાક ૭/૦૦ વાગ્યાના સુમારે અંબિકાનગરના નાકે કચરાના ઠગલામાંથી નવજાત ભૂણ મળી આવતા અમરાઈવાડી પોલીસે અજાણી વ્યક્તિ વિરૂધ્ધ ગુન નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એ.આર.ચૌધરી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૫૨૩/૧૯

વાસણા: ઉષાબહેન વા/ઓ મહેશભાઈ ઠાકોર (ઉ.વ.૨૯) (રહે.કંતાનનગર છાપરાં જોગણીમાતાના મંદિર પાસે સોરાઈનગર વાસણા) એ તા.૨૧/૦૩/૧૯ બપોરના ૪/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે છતની લોખંડની પાઇપ સાથે દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે વાસણા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ વાસણા પોલીસ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.